

GNLU PRESS NOTE No. 35/2014

Workshop

Workshop on Fishermen Legal and Regulatory Framework Awareness

ગુજરાત રાજ્ય ના પાટનગર ગાંધીનગર ખાતે ઓગસ્ટ ૮, ૨૦૧૪ ના રોજ માછીમાર માટે કાયદા અમલવારી અંગે જાગૃત કરવા અંગે સેમીનાર આયોજવામાં આવ્યો.

આ સેમીનાર ગુજરાત ની રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર ના પોલીસ ડીપાર્ટમેન્ટના સહયોગ થી ગુજરાતના ૩૩૩ માછીમારોએ વિવિધ જિલ્લાઓમાંથી હાજરી આપી.

આ સેમીનારમાં ગુજરાત પોલીસ ના ડીરેક્ટર જેનેરલ પોલીસ શ્રી પી.સી.ઠાકુર, IPS, શ્રી સુભાષ ત્રિવેદી, (IPS) DIG, ડૉ. બિમલ એન. પટેલ, ડીરેક્ટર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી તથા ભારતીય રક્ષા દળના શ્રી કુલદીપ સીંઘ શેઓરાન એ હાજરી આપેલ હતી.

આ સેમીનાર માં વિવિધ વિષયો જેવા કે;

- ૧) જુદાજુદા કાયદા દ્વારા જળ માં દરિયામાં સરક્ષણ અને ઘટનાઓની વાત કરવામાં આવી
- ૨) કોસ્ટલ regulatory સ્ત્રોત અને જળવિસ્તાર માં આ કાયદા અંગે વાત કરવામાં આવી
- ૩) મત્સ્ય કાયદો ૨૦૦૩ ની અમલીકરણ વિષે દર. પઈ.સી.મલ્લી એ જાણકારી આપી
- ૪) દરિયા માં મચ્છીમારોને કોસ્ટગાર્ડ દ્વારા મદદ અને સિક્યુરિટી વિષે વાત કરવામાં આવી
- ૫) કોસ્ટગાર્ડ, મત્સ્યઉદ્યોગ અને મરીન પોલીસ ની ભાગીદારી અંગે જાણવામાં આવ્યું

સવારના ૯.૩૦ થી ૧૬.૩૦ કલાક સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓના એસ.ઓ.જી. તથા જીલ્લા સ્તર રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓએ સંપૂર્ણ સફળતા માટે પ્રયાસ કરવામાં આવેલ છે. આ માછીમારો નો રાજ્યસ્તરના સેમિનારમાં વિવિધ વિષયોમાં પ્રો.ડૉ.બિમલ એન. પટેલે કાયદાઓના સહયોગથી મત્સ્ય પ્રવૃત્તિ ની રાજ્ય અને નજીકના રાજ્યોના દરિયાઈ પ્રસંગો ટાંકી સમજદારી આપવામાં આવી.

કોસ્ટલ રેગ્યુલેટર ઝોન અંગે વિવિધ સ્થળો અને કાયદાથી માછીમારોને માહિતગાર કરવામાં આવ્યા. ગ્રીન ફિલ્ડ બોમ્બે ની વાત, કિનારાના પરંપરાગત પ્રોસેસીંગ, માછલીની સુકવણી, ઉતરાણ વગેરે આ કાયદામાંથી બાદ છે તે માહિતગાર કર્યાં.

મત્સ્યોદ્યોગ કાયદો – ૨૦૦૩ ની અમલવારી અને પ્રાથમિક જ્ઞાન અને દેશ વિદેશ ની માછલી, કલરકોડ, લાઈફજેકેટ, બોટ જી. પી. એસ. ચેનલ – ૧૬, ચોરસ ૪૦ એમ. એમ. કોડચેન્ડ ની અમલવારી, જવાબદારી પૂર્વકની માછીમારી અને બાયોમેટ્રિક કાર્ડ, ટોકન બુક વગેરેથી માહિતગાર કરવામાં આવ્યા.

સિક્યોરીટી મત્સ્યોદ્યોગ, ફિશિંગબાન અને મેડીકલ કેમ્પ ની વિવિધ માહિતી આપવામાં આવી.

શ્રી પી.સી.ઠાકુર, IPS સાહેબ અને શ્રી સુભાષ ત્રિવેદી, (IPS) DIG સાહેબ દ્વારા પાંચ વાતો મહત્વ ની સમજવામાં આવી;

- ૧) Color Code
- ૨) GPS
- ૩) LIFE JACKET BOAT
- ૪) BIO-METRIC CARD
- ૫) TRANSPOND

મત્સ્ય ઉદ્યોગ, COSTGAURD અંદ મરીન પોલીસ, કાયદા યુનિવર્સિટી ના પ્રોફેસર પટેલ દ્વારા સમગ્ર બાબતો નો માછીમાર સાથે ના પ્રશ્નો ના તલસ્પર્શી બાબતો અંગે ચર્ચાઓ કરી હતી.

ગુજરાત રાજ્ય ના વિવિધ સ્થળોએથી આવેલ માછીમારો અગ્રણીયો દ્વારા રસપૂર્વક ભાગ લેવામાં આવેલ હતો. આ માછીમારો દ્વારા કાયદા અને અમલવારી ની જવાબદારીની સમજણ વધે અને ગુજરાત નું ગૌરવ વધે તેવી સીખ સાથે પુરા દિવસ ની કાર્યશાળા પૂર્ણ કરવામાં આવી.

For any further information or clarification, Kindly contact to Mr. Sanjeet Ruhel sruhal@gnlu.ac.in or +918128650889.